

ત્વરિત જાહેરાત માટે

## બ્રેમ્પટનના નિવાસીઓ માટે ટર્મ ઓફ કાઉન્સિલ અગ્રિમતાઓ આગળ ધપાવવા માટે બ્રેમ્પટનનું સૂચિત 2020 બજેટ (અંદાજપત્ર).

બ્રેમ્પટન, ઓન્ટારિયો (04 ફેબ્રુઆરી 2020) – સીટી ઓફ બ્રેમ્પટનનું સૂચિત અંદાજપત્ર 2020 હવે [ઓનલાઇન](#) ઉપલબ્ધ છે. સૂચિત 2020 બજેટ ટર્મ ઓફ કાઉન્સિલની અગ્રિમતાઓનું સમર્થન કરે છે જેમાં બ્રેમ્પટન એક સુશાસિત શહેર થાય, ગ્રીન સિટી થાય, નિરોગી અને સુરક્ષિત શહેર થાય, અવસરોનું શહેર થાય જેવા મુદ્દાઓ અને મોઝિએકનો સમાવેશ થાય છે. અંદાજપત્રની ચર્ચાઓનો પ્રારંભ ફેબ્રુઆરી 18મીના રોજ બપોરે 1 વાગ્યે શરૂ થશે અને બજેટની અંતિમ બહાલી ફેબ્રુઆરીની 26મીના દિને સાંજે 7 વાગ્યે ગોઠવવામાં આવેલ છે.

બજેટ સમિતિની બેઠકો, [બજેટ હાઈલાઈટ્સ](#) અને [સંપૂર્ણ બજેટ દરખાસ્ત](#) માટેની [મુખ્ય તારીખો](#)ની સંપૂર્ણ સૂચિ સિટી વેબસાઈટ પર ઉપલબ્ધ છે. સિટી 2020 ના સૂચિત બજેટ અંગેની જાહેર સમીક્ષા અને પ્રતિસાદ આવકારે છે.

સિટીની બજેટ સમિતિને કરવામાં આવેલ પ્રાથમિક દરખાસ્ત 2019ની સરખામણીએ 2020 માટે 1.2% ના કુલ બજેટ વધારા માટેની છે. મંજૂર થાય તો આનાથી બ્રેમ્પટનમાં મિલકત વેરામાં 0.5%નો વધારો થઈ શકે અથવા સરેરાશ દરેક ઘર દીઠ \$27નો વધારો થશે જેથી સિટીના 2020ના બજેટનું નીધિયન થઈ શકે.

પોતાના મિલકત વેરાના બિલમાં કસ્ટોમર વેરામાં કુલ 1.8%નો વધારો જોઈ શકશે અથવા તો સરેરાશ દરેક ઘર દીઠ \$91નો વધારો હશે. આ સંયુક્ત સરવાળો છે જેમાં સિટી ઓફ બ્રેમ્પટનના 0.5%, રિજન ઓફ પીલ તેમજ પીલ ડિસ્ટ્રિક્ટ સ્કૂલ બોર્ડનો સમાવેશ થાય છે.

બજેટની ચર્ચાઓ દરમિયાન સમિતિ કાર્યકુશળતાના વધારાના સુધારા કે રોકાણો અંગેની પરિસ્થિતિઓની સમીક્ષા કરી શકે.

### 2020 બજેટ દરખાસ્તનાં મુખ્ય મુદ્દાઓ

- 120 બસની ખરીદી માટે 3 વર્ષના ગાળામાં \$136 મિલિયન: 88 વિકાસાર્થે અને જૂની થતી ફ્લીટ માટે 32 બસ અવેજમાં મુકવા
- ગ્રીન સિટી બનવાની આપણી વચનબદ્ધતાના પ્રતિબિંબ તરીકે લોકોનું વધુ સુરક્ષિત રીતે પરિવહન કરવા માટે સિટીના માર્ગો અને સક્રિય પરિવહન માર્ગોને અદ્યતન કરવા માટે \$41 મિલિયન

- ત્રણ વર્ષના ગાળામાં રમતગમતના મેદાનો, ટ્રેઈલ્સ અને સ્થાનિક સિટી પાર્ક્સ ખાતેના મેદાનોમાં સુધારા માટે \$9.8 મિલિયન
- શહેરને વધુ સુરક્ષિત બનાવવા કમ્યુનિટી સેફ ઝોનમાં ફોટો રડાર માટે ત્રણ વર્ષના ગાળામાં \$650,000
- વધુ કાર્યક્ષમ ઊર્જા ઉપભોગ માટે જૂની સ્ટ્રીટ લાઈટમાં LED બેસાડવા માટે ત્રણ વર્ષના ગાળામાં \$9 મિલિયન
- ત્રણ વર્ષના ગાળામાં કિવન સ્ટ્રીટ રેપિડ ટ્રાન્ઝિટ પ્રાથમિક ડિઝાઈન (Queen Street Rapid Transit Preliminary Design) (એટલેકે ટ્રાન્ઝિટના બાંધકામ માટેના નકશા, અંતિમ ડિઝાઈનની યોજના અને વિશિષ્ટતાઓ સહિતના તમામ દસ્તાવેજો જે પરિયોજનાના બાંધકામ કોન્ટ્રેક્ટ માટે આવશ્યક હોય) માટે \$8 મિલિયન.
- વધુ સારા પ્રાદેશિક જોડાણ માટે માર્ગ ખુલ્લો કરવા ત્રણ વર્ષના ગાળામાં હુરોન્ટારિયો મેઈન સ્ટ્રીટ (Hurontario Main-Street) LRT માટે \$2.9 મિલિયન
- સેંચુરી ગાર્ડન્સ (Century Gardens) ખાતે નવા યુથ સેંટરો અને સાઉથ ફ્લેચર્સ રિક્રિએશન સેંટરો (South Fletcher's Recreation Centres) માટે \$2 મિલિયન
- ડાઉનટાઉન બ્રેમ્પટનમાં રાયરસન ઇનોવેશન ઝોન (Ryerson Innovation Zone) માટે પાંચ વર્ષના ગાળામાં \$5 મિલિયન
- આગ સામે વધુ ઝડપી અને વિશ્વસ્નીય પ્રતિસાદ માટે અગ્નિશમન સાધનો અને બ્રેમ્પટનના અગ્નિશમન માટેના બંબા (Fire trucks)ને અદ્યતન કરવા ત્રણ વર્ષના ગાળામાં \$9.8 મિલિયન

### પોતાનો મત દર્શાવો

સૂચિત બજેટની સમીક્ષા કરવા અને આપના પ્રતિભાવ આપવા નિવાસીઓ, વેપારી પેઢીઓ અને હિસ્સાધારકોને નીચેની કોઈ પણ રીતે આપવા સિટી આહવાન કરે છે:

- ઈમેલ મોકલો: પ્રશ્ન પૂછો અથવા અહીં ટિપ્પણી કરો [budget@brampton.ca](mailto:budget@brampton.ca).
- ફોન ઉઠાવો: આપના સૂચનો આપવા માટે 311 પર કોલ કરો.
- ટેલિફોન ટાઉન હોલમાં જોડાવ: 18 ફેબ્રુઆરીના રોજ સાંજે 7 થી 8 વાગ્યા સુધી ટેલિફોન ટાઉન હોલમાં ભાગ લો, જ્યાં સંભાવનાને આધારે થયેલ પસંદગીના ફોન નંબરો પર કોલ કરવામાં આવશે. કોલની સૂચિમાં પોતાનો ટેલિફોન નંબર ઉમેરવા માટે ફેબ્રુઆરીની 17મી સુધીમાં [સિટી વેબસાઈટ પર સાર્ઠન-અપ કરો](#).
- વ્યક્તિ નિયુક્ત કરો: બજેટ સમિતિ અથવા બજેટ બહાલી કાઉન્સિલ સભામાં હાજરી આપવા અને બોલવા માટે [નિયુક્ત વિનંતી](#) રજૂ કરો. નિયુક્તિના ફોર્મ સીટી હોલ, 2 વેલિંગ્ટન સ્ટ્રીટ વેસ્ટ (2 Wellington Street West) ખાતે સિટી કલર્કના કાર્યાલયમાં રૂબરૂમાં પણ ભરી શકાશે.
- બેઠકમાં હાજરી આપો: સિટી હોલ ખાતે બજેટ સમિતિની બેઠકોમાં હાજરી આપો અને બજેટ સમિતિની બેઠકના અંતે જનતાના પ્રશ્નો માટેના સમયગાળામાં તે દિવસની કાર્યસૂચિ અંગેના પ્રશ્નો પૂછો.

## અવતરણો

"બ્રેમ્પટનનું સૂચિત 2020 બજેટ ટર્મ ઓફ કાઉન્સિલ અગ્રિમતાઓ દ્વારા માર્ગદર્શિત છે અને તે ઉચ્ચ-ગુણવત્તાવાળા કાર્યક્રમો અને સેવાઓ પ્રદાન કરવા, વિકાસના અવસરો હસ્તગત કરવા અને રાષ્ટ્રીય અને વૈશ્વિક વલણો પ્રત્યે ચપળતા કેળવવા અને પ્રતિભાવ આપવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. પ્રચાલન કાર્યક્ષમતા અને આવક વૃદ્ધિને કારણે બજેટ સમિતિમાં જતા આ મુસદ્દામાં મિલકત વેરાનો વધારો વ્યાજબી કરવામાં મદદ મળી છે. સિટી ખુલ્લી અને પારદર્શક રીતે બજેટની ચર્ચાઓ હાથ ધરવા પ્રતિબદ્ધ છે અને શહેર વિકાસની આવી અગત્યની પ્રક્રિયામાં બ્રેમ્પટનવાસીઓના મતો આવકારે છે."

- ડેવિડ બેરિક્ક, મુખ્ય વહીવટકર્તા (David Barrick, Chief Administrative Officer)

"બજેટ દરખાસ્ત, વધતી જતી વસ્તીની જરૂરિયાતોને સંતુલિત કરવા, અને આપણા રહેવાસીઓ અને વ્યવસાયિકો દ્વારા ઉત્તમ સેવાઓ માટે રાખવામાં આવતી અપેક્ષાઓ, સૌથી કાર્યક્ષમ અને કિફાયતી રીતે પહોંચાડવાની સિટી ઓફ બ્રેમ્પટનની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને પરિવહનમાં થતા નિરંતર નિવેશથી આપણી સંપત્તિના સમારકામ અને રિપ્લેસમેન્ટની વધતી આવશ્યકતાઓ અને ભવિષ્યમાં આપણા ટ્રાન્ઝિટ નેટવર્કના ચાલુ રહેલ વિસ્તરણને સંબોધિત કરવામાં મદદ મળશે."

- ડેવિડ સટ્ટન, ખજાનચી (David Sutton, Treasurer)

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રેમ્પટનમાં 650,000 લોકો વસે છે અને તેમાં 70,000 વ્યવસાયો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતી યાત્રાનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. અહીં વધુ જાણકારી મેળવો [www.brampton.ca](http://www.brampton.ca).

મિડિયા સંપર્ક :

મોનિકા ડુગ્ગલ

કોઓર્ડિનેટર, મિડિયા એન્ડ કમ્યુનિટી એંગેજમેન્ટ

વ્યૂહાત્મક સંવાદ

સીટી ઓફ બ્રેમ્પટન

905-874-3426 | [Monika.Duggal@brampton.ca](mailto:Monika.Duggal@brampton.ca)